

Hasauli main Road to gadav Tol
Schedule XLV - Form NO.-134.

FDR

BIHAR P. W. D.

JHANSI HAR PUR

DIVISION

MADHE PUR

SUB-DIVISION

MEASUREMENT BOOK

1802

प्रमाणित किया जाये कि
 कापी 3/1/2017 गरीब 21/1 को
 मार 100 पत्रों में जो कि हस्त
 लिखित पत्रों को भी
 मारा है।

(Signature)

कार्यपालक अभियंता
 ग्रामीण कार्य विभाग
 झंझारपुर
 03/12/17

(Faint handwritten text, mostly illegible)

Name of the work-
 Situation of work-
 Agency by which work is executed-
 Date of measurement-
 No. and date of agreement-
 (These four lines should be repeated at the commencement of
 the measurements relating to each work)

01

Particulars	Details of actual measurement				Contents of area
	No.	L.	B.	D.	

CH - FDR

Name of Work: - Repair of Flood damage
 road from Hasauli main road to
 Yadav Tal under FDR in
 Madhapur Block.

Agency: - Departmental

Date of measurement/Entry: - 16/5/21

Authority: - SE T.A. Letter No: - 934
 6/5/21

1) Plv and laying of brick
 bats with carriage by
 tractor etc - - -

all complete.

$$1 \times 23.00 \times \frac{4.0 + 6.0}{2} \times \frac{0.60 + 1.18}{2} = 102.35$$

$$7 \times 30.00 \times 4.00 \times \frac{0.60 + 0.45}{2} = 441.00$$

$$1 \times 15.00 \times 4.00 \times \frac{0.60 + 0.45}{2} = 31.50$$

574.85 m³

$$@ Rs 1857.76/m^3 - Rs 10,73,682.00$$

$$\text{Add 12\% G.S.T.} - Rs 1,28,842.00$$

$$\text{Add 1\% L.C.} - Rs 10736.00$$

$$\text{Add S.F.} - Rs 61,106.00$$

$$Rs 12,74,367.00$$

①

(2) Excavation for roadwork in
 soil with hydraulic excavator
 including cutting, loading and
 trimming etc - - - all complete.

Continuation

Particulars	Details of actual measurement				Contents of area
	No.	L.	B.	D.	
$7 \times 30.00 \times \frac{4.50 + 0.75}{2} \times 0.40$					220.10 m^3
$1 \times 15.00 \times \frac{4.0 + 5.0}{2} \times 0.40$					27.00
					371.25 m^3
					247.50
@ Rs 68.71 / m^3					$\text{Rs } 25,505.00$
Add 12% G.S.T.					$17,006.00$
					$\text{Rs } 30,611.00$
Add 1% L.C.					204.10
					$\text{Rs } 25.50$
Add S.F.					170.00
					$\text{Rs } 1292.00$
					862.00
					$\text{Rs } 30,113.00$
					2007.90
Total cost (1+2)					$\text{Rs } 30,113.00$
					$12,94,442.00$

15/12/21
JL

15/12/21
A.E.

15/12/21
JL